Shri Jagdamba Polymers Limited





Date: November 10, 2021

To, BSE Ltd DCS – Department of Corporate Services Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai – 400 001

Dear Sir/Madam.

Sub: Newspaper cuttings of published unaudited Financial Results of the Company for the Quarter and Half Year Ending on September 30, 2021.

Ref: Scrip Code - 512453

This is with reference to the captioned subject.

Please find enclosed the newspaper cuttings of published unaudited Financial Results of the Company for the Quarter and Half Year ending on September 30, 2021 of the Company in English and Gujarati newspaper paper – Financial Express dated November 10, 2021

Please take note of the same.

Thanking You

For, Shri Jagdamba Polymers Limited

Company Secretary

FINANCIAL EXPRESS

BAJAJ FINANCE LIMITED

CORPORATE OFFICE: 3RD FLOOR, PANCHSHIL TECH PARK, VIMAN NAGAR, PUNE-411014, MAHARASHTRA. BRANCH OFFICE: Bajaj Finance Ltd., The Imperial Heights, B-Wing, 5th Floor, 150 Feet Ring Rd, opp. Big Bazar, Rajkot, Gujarat 360005

BIDDING NOTICE Authorized Officer's Details: Name: Nilesh Patel Email ID: nilesh.patel@bajajfinserv.in Mob No. 079-30018224,8669189048 UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF THE SECURITY INTEREST ACT 2002 ('Act')

Notice is hereby given to the public in general that the below mentioned Borrower/co-borrower mortgaged the immovable property which is described hereunder to Bajaj Finance Limited ("BFL") and the possession of the said immovable property ('secured asset/property') has been taken over by the Authorized Officer in accordance of the SARFAESI Act 2002 and rules there to. The secured asset will be sold through public auction by bidding for realization of the loan dues, applicable interest, charges and costs etc., payable to BFL as detailed below. The secured asset is being sold on and the bidding will be held on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER THERE IS" AND "WITHOUT RECOURSE BASIS" under the rule number 8 & 9 of the Security Interest (Enforcement) Rules (hereinafter referred to as the rules) and on the terms and conditions specified here-under:

Borrowers Name & Address BORROWER . SHREE UMIYAJI SALES AGENCY At SHREE UMIYAJI SALES AGENCY 15 A VIJAY PLOT DIZAL MMANUFACTURES RAJKOT-360003

Secured debt for recovery Names of the Co-Borrowers with address of which property is sold. (Co-Borrower) TOTAL Rs. 2,55,31,956/- (Rupees Two HARESH GODHANI NR Crore Fifty Five Lac Thirty One Thousand At SARITA PARK SOC UNI RD BH YOGESHVAR PARK I Nine Hundred Fifty Six Only) MADH RAJKOT-360005

Along with future interest and charges PARSOTTAMBHAI GODHANI At SARITA PARK SOC UNI ROAD BH YOGESHVAR PARK NR accrued w.e.f 05-Oct-2021 in Loan Account Number 416LAP28187257 MADH RAJKOT-360005

PUBLIC AUCTION

THROUGH

		12 per 11 10 00 e 20 e 20 e			416LAP28187257		
Title Deed Holder Name			Place, Date and Time of the Opening of Bids	Reserve price/ EMD/Bid Increment		Last Date and time for submission of the	
SHREE UMIYAJI SALES AGENCY	Sub Plot No. 15/A Dharmraj Par Opp- Satellite Park, Sadhuvasw Boundaries: - North Sub Plot 15 Road, West Plot No 17 Sub Plot No 6+7+8/C Sarita I Saduvaswani Road Rajkot 3600 Boundaries: - North Sub Plot 6+7+8/B, East Road, West R.S.	ani Road, Rajkot-360005 /B, South Plot no 16, East Park Param Street No 3 105 6+7+8/D, South Plot no	Date: 15-December-2021 Time: 2.00 PM Place: Bajaj Finance Ltd, The Imperial Heights, B-Wing, 5th Floor, 150 Feet Ring Rd, opp. Big Bazar, Rajkot, Gujarat 360005	Only) SUB PLOT PARK PARAM AN is fixed at	K HET PRIT serve Price.	request letter for participation / KYC Documents/ Proof of EMD etc. 15-December-2021 at 10:00AM	

DATE AND TIME OF INSPECTION OF THE PROPERTY: FROM 15/11/2021 to 14/12/2021 BETWEEN 10:00 AM AND 4:00 PM

Terms and Conditions of the Public Auction are as under:

- 1. Public Auction is being held on "AS IS WHERE IS, AS IS WHAT IS AND WITHOUT RECOURSE BASIS" and is being sold with all the existing and future encumbrances whether known or unknown to Bajaj Finance Limited. The bid form, Declaration, General Terms and Conditions of Public Auction can be obtained from office of Bajaj Finance Ltd, The Imperial Heights, B-Wing, 5th Floor, 150 Feet Ring Rd, opp. Big Bazar, Rajkot, Gujarat 360005.
- The Secured asset will not be sold below the Reserve price.
- To the best of the knowledge and information of the Authorized Officer, there is no encumbrance on the properties. However, it is necessary that the intending bidders should make their own independent inquiries regarding any claims, charges, dues, encumbrances and should satisfy about the title, extent/measurement of the property prior to submitting their bid. For any discrepancy in the property the participating bidder is solely responsible for all future recourses from the date of submission of bid.
- No claim of whatsoever nature regarding the property put up for sale, charges/encumbrances over the property or on any other matter etc will be entertained after
- The Authorized Officer/BFL will not be responsible for any charge, lien, encumbrance, property tax dues, electricity dues etc. or any other dues to the Government, local authority or anybody, in respect of the property under sale.
- The Public Auction notice/advertisement does not constitute and will not be deemed to constitute any offer, commitment or any representation of Bajaj Finance Limited. The Authorized Officer/BFL shall not be responsible in any way for any third party claims/rights/dues.
- The Sale shall be subject to the rules/conditions prescribed under the SARFAESI Act 2002 and rules thereto. It shall be the responsibility of the bidders to inspect (a) the title and link documents and (b) the property and satisfy themselves about the secured asset and
- specification before submitting the bid. Before entering the premises for inspection, it is necessary that the interested purchaser shall provide their identity, address and contact details in the register confirming their entry and exit from property under their signature. The interested bidders shall submit their bids along with EMD, which shall be payable only through D.D. in favour of Baiai Finance Limited payable on or before the last day and time mentioned above.
- 10. The Bids along with other documents must be submitted to the Authorized Officer in a sealed envelope mentioning 'Offer for Purchase- 1. SHREE UMIYAJI SALES AGENCY, 2. HARESH GODHANI, 3. PARSOTTAMBHAI GODHANI, 4. ASHWIN P GODHANI, LAN: 416LAP28187257, 416LAP28187257 to reach the Authorized Officer on or before the last date of submission of the Bids
- 11. The bidder is supposed to submit the following documents at the time of submission of the bid: i) Proof of EMD paid ii) copy of the Pan Card iii) Proof of identification/ Address proof/Aadhaar Card/KYC (self-attested copies) without which the bid is liable to be rejected.
- The bidder alone can participate in the public auction proceeding and no other person is permitted.
- The successful Bidder must deposit the 25% of the purchase amount (after adjusting the EMD already paid) immediately upon the acceptance of the offer and declaration of the successful bidder by the Authorized officer, failing which the EMD paid shall be forfeited and cannot be claimed by the bidder from Bajaj Finance
- The balance 75% of the purchase amount must be deposited by the successful bidder within 15 days, failing which the amounts already deposited by the bidder shall stand automatically forfeited without further notice and no request for refunds whatsoever shall be entertained. Further, the property will be put to re-auction and the defaulting bidder shall have no claim/right in respect of the property/amount and will not be eligible to participate in the re-auction, if any.
- No interest is applicable to EMD or any amount deposited by the bidders/successful bidder in respect of sale of secured asset.
- 16. The Purchaser/successful bidder shall bear the (a) applicable stamp duty/registration/transfer charges; (b) all the statutory, non-statutory, conversion, electricity, sewage charges, any dues, cess, fees, taxes, rates, assessment charges etc. owing to any person, association or authority shall be borne by the successful Bidder only.
- Sale certificate shall be issued in the prescribed format in favor of successful bidder only.
- 18. The successful bidder shall have to arrange for registration etc., at his/her/its cost of the sale certificate as per the provisions of prevailing Stamp and Registration Act. The successful bidder shall bear the charges for conveyance, registration fee, stamp duty, taxes, fee etc. as applicable.
- In case of sale of property subject to any encumbrances, the successful bidder/purchaser shall deposit money required to discharge the encumbrance including interest, cost, expenses etc. if any to the Authorized officer.
- 20. In case if the public auction is stopped, stayed, postponed or rescheduled or cancelled, a public notice will be put on the notice board of BFL branch and no personalized/individual communication in this regard will be sent to any of the bidders or otherwise.
- 21. Submission of bid by the bidders is construed that they have read, understood and accepted the terms and conditions governing the public auction. 22. EMD of unsuccessful bidders shall be returned on the closure of auction proceedings.
- 23. The Authorized officer is not bound to accept the highest offer/bid and the Authorized officer has absolute right to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel the public auction without assigning any reason thereof.
- For more details please visit: https://www.bajajfinserv.in//SHREE-UMIYAJI-SALES_AGENCY.pdf

Date: 10/11/2021 Authorized Officer. Place:- Gujarat Nilesh Patel Bajaj Finance Limited OMKARA ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED

Regd. Office: 9, M.P. Nagar, 1st Street, Kongu Nagar Extn, Tirupur - 641607.Ph No. 04212221144 Corporate Office: C/515, Kanakia Zillion, Junction of LBS Road and CST Road BKC Annexe, Near Equinox, Kurla (West), Mumbai – 400070. Tel.: 022-26521804

[Appendix - IV-A]

[See proviso to rule 8 (6) and Rule 9(1)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY DATE OF E-AUCTION: December 13, 2021

of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) and Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the below mentioned Borrower and Co-Borrower(s) named hereinafter that the below described immovable property mortgaged/charged to the Secured Creditor i.e. Capri Global Housing Finance Limited (CGHFL), Further vide Registered Assignment Agreement dated 30th March 2020, CGHFL has absolutely assigned & transferred the financial asset/entire outstanding debt lying against the said borrowers & mortgagor guarantor along with underlying securities and their all rights and powers in favor of M/s Omkara Assets Reconstruction Private Limited (OARPL), acting in the capacity of Trustee of PS 24/2019-20 Trust related to the credit facility provided to Borrower/

Co- Borrowers. Further M/s Omkara Assets Reconstruction Private Limited (OARPL), acting in the capacity of Trustee of PS 24/2019-20 Trust has

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement

taken physical possession of the secured asset. Accordingly, OARPL has stepped into the shoes of CGHFL, the original secured creditor and become is entitled to recover dues and enforce the securities. Property will be sold in exercise of rights and powers under the provisions of sections 13 (2) and (4) of SARFAESI Act; on "As is where is" "As is what is", and "Whatever there is" and "Without recourse Basis" on 11.12.2021 at 1.00 PM (last date and time for submission of bids is 13.12.2021 up to 4.00 PM), for recovery of amount shown below in respective column due to OARPL as Secured Creditor from respective Borrower and Co-Borrower(s) shown below. The Reserve Price and the earnest money deposit for respective property has been mentioned below in respective column.

Name of Borrower	Date of Demand	Description of immovable property	Reserve Price	Inspection	Outstanding		
and Co-Borrower(s)	Notice		EMD	Date and Time	Dues in Rs.		
Borrower -Mr. Ashish Ashokbhai Sorthiya	21.07.2020	21.07.2020 All that Piece and Parcel of Plot No 95,Rameshwaram Bunglow, bearing Revenue		Date: 09.12.2021 Time:	Rs.26,56,931/- (Rupees Twenty Six Lakhs Fifty Six		
Co - Borrowers Kirtiben Ashishbhai Sorathiya	Possession 16.06.2021 Block No. 269/A (As per K.J.P Block No. 269/A/95, New Block No. 1539) Nr.Polytechnic College, Village - Valia, Taluka - Akleshwar, District - Bharuch, Gujarat 392001		EMD Rs. 1,09,000/-	11 AM to 2 PM	Thousand Nine Hundred Thirty One Only) as or 08.11.2021 alongwith future interest and other charges.		
Minimum Bid Incremen	t Amount	io di	Rs. 10,000/- (Rs. T	en Thousand Only)			
Borrower -Mrs. Induben Pravinbhai Savaliay	21.07.2020	All that Piece and Parcel of Plot No 82, (admeasuring 139.45 sq.mts.) Rameshwaram	Reserve Price Rs. 10,47,000/-	Date: 09.12.2021 Time:	Thirty Six Lacs Fifty Si		
Co - Borrowers Pravinbhai Ramjibhai Savaliya	Possession 16.06.2021 Bunglows, Block No. 269-A, Nr. Politechnique, Valia, Bharuch, Gujarat 393		EMD Rs. 1,04,700/-		Thousand Six Hundred Thirty One Only) as on 08.11.2021 alongwith future interest and other charges.		
Minimum Bid Incremen	t Amount		Rs. 10,000/- (Rs. T	en Thousand Only)	interestand outer charges.		
Borrower - Mr. Janmejaykumar	21.07.2020	All that Piece and Parcel of Plot No 4, (admeasuring 75 sq. mtrs.), Radhe Krishna	Reserve Price Rs. 14,25,000/-	Date: 09.12.2021 Time:	Rs.40,74,526/- (Rupees Fourty Lacs Seventy Four Thousand Five Hundred Twenty Six Only) as on 08.11.2021 alongwith future interest and other charges.		
Purani Co - Borrowers Pujari Arunaben Janmejay bhai	Date of Physical Possession 16.06.2021	Residency, Block/Survey no. 125, Paiki, Village Chavej, Bharuch Gujarat 392002 .	EMD Rs. 1,42,500/-	11 AM to 2 PM			
Minimum Bid Incremen	t Amount		Rs. 10,000/- (Rs. T	en Thousand Only)			
Borrower - Mr. Mukeshbhai	21.07.2020	All that Piece and Parcel of Plot No 92, (admeasuring 139.45 sq.mts.) Rameshwar	Reserve Price Rs. 10,47,000/-	Date: 09.12.2021 Time:	Rs.41,82,928/- (Rupees Forty one Lacs Eighty Two Thousand Nine Hundred Twenty Eight Only) as on 08.11.2021 alongwith future interest and other charges.		
B Mangrolia Co - Borrowers Dayaben Mukeshbhai Mangrolia	Date of Physical Possession 16.06.2021	Bunglows, Block No. 269-A, Nr. Valia Politechniq, Valia, Bharuch Gujarat 393125	EMD Rs. 1,04,700/-	11 AM to 2 PM			
Minimum Bid Incremen	t Amount		Rs. 10,000/- (Rs. T	en Thousand Only)	e partir en este este apresentation de la company de la co		

TERMS & CONDITIONS:

1.The auction sale will be conducted online through the auctioneer portal www.bankeauctions.com on "As is where is", "As is what is" "whatever there is" and "Without Recourse Basis" 2. The secured assets will not be sold below Reserve Price. All statutory dues/ attendant charges/other dues including registration charges, stamp duty, taxes etc. shall have to

be borne by the successful bidder 3 Property under the consideration is put for auction excluding the inventory lying within the property and OARPL shall have the right to put the inventory for auction separately

4. The last date for payment of EMD, and submission of Bid Form & Documents to Authorised Officer is 11.12.2021 up to 4.00 PM at C/515, Kanakia Zillion, Junction of LBS Road and CST Road BKC Annexe, Near Equinox, Kurla (West), Mumbai or at email id ankur.rastogi@omkaraarc.com. 5. To the best of knowledge and information available on record, there is no encumbrance on the property. However, the intending bidders should make their own independen

due diligence and inquiries regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/ effecting the property, prior to submitting their bid. The E-Auction advertisement does not constitute and shall not be deemed to constitute any commitment or any representation of the OARPL. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the OARPL

6The successful bidder shall deposit 25% of bid amount (after adjusting EMD) immediately i.e., on the same day but not later than the next working day, as the case may be and balance 75% amount must be paid within 15 days from confirmation of sale. On failure to pay the sale price as stated all deposits including EMD shall be forfeited without further notice. However, extension of further reasonable time to make the balance 75% payment in exceptional situations shall be at sole discretion of authorized officer and subject to terms & conditions as may be agreed upon in writing between the purchaser and the secured creditor in accordance with applicable provisions of law.

7. Property will be sold to bidder quoting the highest bid amount. Inter-se bidding will be at sole discretion of Authorised Officer. However, the Authorized Officer has the absolute power and right to accept or reject any tender/bid or adjourn/ postpone the sale without assigning any reason whatsoever thereof. 8 Bids below reserve price or without EMD amount shall not be accepted. 9. The bid once submitted cannot be withdrawn and the bidder has to purchase the property for the quoted price in case the same is the highest bid, failing which EMD shall be

10. Interested parties are advised to independently verify the area of land, building and other details. Secured Creditor do not take any responsibility for any errors / omissions / discrepancy / shortfall etc. in the Secured Asset or for procuring any permission, etc. or for the dues of any authority established by law

11. The interested bidders shall submit their EMD details and documents through Web Portal: bankauctions.com through Login Id & Password. The EMD amount should be paid by way of Demand Draft/ Pay Order/ NEFT / RTGS payable at Mumbai in favour "Omkara PS 24/2019-20 Trust" which is refundable without interest to the unsuccessful 12. The intended bidders who have deposited the EMD and require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e-bidding process etc., may contact e-Auction Service Provider "M/s. C1 India Pvt. Ltd", Tel. Helpline: +91-7291981124/25/26, Helpline E-mail ID: support@bankeauctions.com .Mr. Jay Singh, Mobile: 77388 66326, E Mail - jay.singh@c1india.com, or Mr. Haresh Gowda, Mobile: 95945 97555 E mail - hareesh.gowda@c1india.com, and for any property related query

may contact the concerned Authorised Officer Ankur Rastogi (Mobile - 9719111855 / 8218904686), E-Mail: ankur.rastogi@omkaraarc.com at address as mentioned above in office hours during the working days. 13. The highest bid shall be subject to approval & confirmation of Omkara Assets Reconstruction Pvt. Ltd (the secured creditor). The Authorised Officer reserves the right to postpone/cancel or vary the terms and conditions of auction and accept/ reject all or any of the offers/ bids so received without assigning any reasons whatsoever. His decision

shall be final & binding. 14. The bidders must hold valid e-mail address and may participate in e-auction for bidding from their place of choice. Internet connectivity shall have to be ensured by bidder himself. OARPL/service provider shall not be held responsible for the internet connectivity, network problems, system crash down, power failure etc.

16. The Authorised officer/secured creditor shall not be responsible for any error, inaccuracy or omission in the said proclamation of sale. 17. All bidders are advised to visit on www.omkaraarc.com / http://omkaraarc.com/auction.php or www.bankeauctions.com for detailed terms and conditions of E-Auction.

15. OARPL reserves its right to sell the property through private treaty as per law, in the event of failure of e-auction.

2002, STATUTORY NOTICE FOR SALE UNDER Rule 8(6) and 9(1) OF STATUTORY INTEREST (ENFORCEMENT) RULES This notice is also a mandatory Notice of not less than 30 (Thirty) days to the Borrower/ Co-Borrower(s) of the above loan account under Rule 8 (6) of Security Interest (Enforcement) Rule, 2002 and provisions of Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, informing them about holding of auction/sale through e-auction on the above referred date and time with the advice to redeem the assets if so desired by them, by paying the outstanding dues as mentioned herein above along with cost & expenses. In case of default in payment, the property shall at the discretion of the Authorized

Officer/Secured Creditor be sold through any of the modes as prescribed under Rule 8 (5) of Security Interest (Enforcement) Rule, 2002.

Authorized Officer, Omkara Assets Reconstruction Pvt Ltd. Date: 10.11.2021 (Acting in its capacity as a Trustee of Omkara PS 24/2019-20 Trust) Place: GUJRAT



GUJARAT METRO RAIL CORPORATION (GMRC) LIMITED

(SPV of Govt. of India and Govt. of Gujarat) Block No.1, First Floor, Karmayogi Bhavan, Sector 10/A, Gandhinagar: 382010, Gujarat. (CIN): U60200GJ2010SGC059407

ENDER NOTIFICATION No: GMRC/IESC/AHMEDABAD/PH-II/2021 Date: 10.11.2021

E-Tenders are invited from reputed and experienced Contractors for the following tender: Tender Name Tender Fees "Engagement of an Independent Environmental and Social Consultant for Ahmedabad Metro Rail

Project Phase - II" Interested bidders are requested to visit https://gmrc.nprocure.com for eligibility criteria, applying/downloading the tender document. Last date and time for Bid Submissions is 15:00 Hrs on 15.12.2021. Any alterations in Eligibility Criteria cum Qualification Requirements, and terms of the Tender Document, or any amendment to the Tender Document, etc, will be uploaded on https://gmrc.nprocure.com and

GMRC's Website www.gujaratmetrorail.com without any obligation

or press notification or other proclamation.

Managing Director, GMRC, Gandhinagar



Bavla Branch 17,18 Shivganga Complex, Station Road, Bavla, Ahmedabad 382220 Phone No.: 02714-230191 Email: bavla@bankofbaroda.com

E-AUCTION - SALE NOTICE

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as the Act)

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/charged/hypothecated to Bank of Baroda, the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is basis" on 08th December, 2021 for recovery of below mentioned account/s The details of Borrower's/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below

Sr. No.	Branch	Name & address of Borrower/s /Guarantor/s	Description of Properties	Total dues	Type of Possession	Reserve Price, EMD and Bid Increase Amount	Contact Person
1	Bavla	Abdulrahim Noorbhai Vohra Aiyubbhai Abharambhai Vohra		Total dues Rs.13,23,469.73/-(Rupees Thirteen lacs Twenty Three Thousand Four Hundred Sixty Nine and Paisa Seventy Three only) As per Demand Notice u/s 13(2) dated 22.12.2016 and further interest thereon at the contractual rate plus cost, charges and expenses w.e.f. 22.12.2016 less recovery thereafter, if any.	Physical	Reserve Price; Rs.8,50,500/- E M D: Rs.85,050/- Bid Inc.:Rs.10,000/-	Shri Akash M Burad Mob. No. 9978446569 Shri K R Chauhan Mob. No. 9898260305
2	Bavla	Maksudbhai Noorbhai Vohra Mohamedsohil Aiyubbhai Vohra		Total dues Rs.13,08,796.89/-(Rupees Thirteen lacs Eight Thousand Seven Hundred Ninety Six and Paisa Eighty Nine only) As per Demand Notice u/s 13(2) dated 21.06.2018 and further interest thereon at the contractual rate plus cost, charges and expenses w.e.f. 21.06.2018 less recovery thereafter, if any.	Physical	Reserve Price: Rs.8,50,500/- EMD: Rs.85,050/- Bid Inc.: Rs.10,000/-	Shri Akash M Burad Mob. No. 9978446569 Shri K R Chauhan Mob. No. 9898260305

Date & Time of E-auction: 08.12.2021, 02:00 PM to 06:00 PM Property Inspection Date & Time: 01.12.2021, 11:00 AM to 02:00 PM

All the taxes/ GST as per Govt, rules applicable shall be payable by the purchaser on sale of movable/immovable assets. For detailed terms and conditions of sale, please refer to the link provided in

https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective bidders may contact the authorized officer Mr....K R Chahuhan....., Chief Manager, Bank of Baroda, Mobile No...9898260305

AS PER SARFAESI Act, STATUTORY -15- DAYS SALE NOTICE TO THE BORROWER /GUARANTOR/ MORTGAGOR The above mentioned borrower /s is/ are hereby noticed to pay the sum as mentioned in section 13(2) Notice in full before the date of auction, failing which property will be auctioned / sold and balance dues if any will be recovered with Interest and cost from borrowers/ guarantors /mortgagor.

Date: 10.11.2021, Place: Ahmedabad Authorised Officer, Bank of Baroda



SHRI JAGDAMBA POLYMERS LIMITED

5000/-

CIN: L17239GJ1985PLC007829 Registered Office: 802 Namarayan Complex, Nr. Navrangpura Post Office, Navrangpura, Ahmedabad-380009, Gujarat, India. E-mail Id: admin@jagdambapolymers.com Website: www.shrijagdamba.com Tel No.: 079-26565792

			(₹ In La	akhs except EPS)
Sr. No.	Particulars	Quarter Ending on 30.09.2021	Year to Date Figures Previous Year ending 31.03.2021	Corresponding Three Months Ended in the Previous Year 30.09.2020
1	Total income from operations (net)	8480.29	23855.83	7005.83
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1800.72	5390.59	1070.92
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	1800.72	5390.59	1070.92
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1447.90	4090.64	854.37
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	(195); (3-	8
6	Equity Share Capital	87.58	87.58	87.58
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)	2	13190.49	
8	Face Value Of Equity Share Capital	₹1	₹1	₹1
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	16.53	46.59	9.76
-				

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com and company website www.shrijagdamba.com

For, Shri Jagdamba Polymers Ltd. Date: 09.11.2021 Place : Ahmedabad

GOKUL REFOILS AND SOLVENT LIMITED State Highway No. 41, Nr. Sujanpur Patia, Sidhpur-384151

Extract of Standalone and Consolidated unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2021

		S	tandione Resul	ts		Consolidated Results				
Particulars	Quarter ending 30.09.2021	ending Quarter endin 2021 30.09.2020		30.09.2020	Year ending 31.03.2021	Quarter ending 30.09.2021	Quarter ending 30.09.2020	Half Year ended 30.09.2021	Half Year ended 30.09.2020	Year ending 31.03.2021
	(Unaudited)	(Unaudited)	(Unaudited)		Audited	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	Audited
Total income from operations (net)		58.01	0.00	108.17	1002.77	69178.56	63339.48	141960.24	119269.90	246466.59
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	68.44	74.00	118.49	159.27	357.65	929.56	682.79	1716.27	1190.84	2689.57
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	68.44	74.00	118.49	159.27	357.65	929.56	682.79	1716.27	1190.84	2689.57
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	57.81	59.40	101.83	129.37	295.68	726.10	513.91	1310.65	909.81	2045.64
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		58.88	99.21	128.32	289.67	725.91	504.76	1310.09	894.98	2051.29
Equity Share Capital	1,979.90	2,637.90	1,979.90	2,637.90	1,979.90	1,979.90	2,637.90	1,979.90	2,637.90	1,979.90
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)			1		19268.23			1		25753.08
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations) -			(.							
Basic :	0.06	0.05	0.10	0.10	0.30	0.73	0.39	1.32	0.69	2.07
Diluted :	0.06	0.05	0.10	0.10	0.30	0.73	0.39	1.32	0.69	2.07

format of unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited Financial Results are available on the Stock Exchange websites and compny's website on www.gokulgroup.com (3) The above results for the quarter and half year ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable. For Gokul Refoils & Solvent Limited

Balvantsinh C. Rajput Chairman & Managing Director

/Re in lakhe



financialexp.epapr.in

Ramakant Bhojnagarwala (Managing Director) (DIN. 00012733)

Place: Ahmedabad

Date: 09.11.2021

CIN: L17239GJ1985PLC007829 રજીસ્ટર્ડ ઓફિસ : ૮૦૨, નરનારાયણ કોમ્પ્લેક્સ,

નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦૦૦૯, ગુજરાત, ઈન્ડિયા. દાંમેકલ : admin@jagdambapolymers.com વેલસાઇટ : www.shrijagdamba.com હેલી. નં. : ૦૭૯-૨૬૫૬૫૭૯૨

તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પુર્ણ થયેલ ત્રિમાસિક અન-ઓડિટેડ નાણાંકિય પરિણામો

34		(ર લાખમાં ઈપીએસ સિવ					
oi.	વિગતો	ત્રિમાસિક ના અંતે 30.06.૨૦૨૧	પાછલા વર્ષના અંતે 3૧.૦૩.૨૦૨૧	पाछखा वर्ष			
100	સંચાલનિય કુલ આવક(ચોખ્ખો)	Sarage		BINIBLE -			
5	ચોખ્ખો નકો સમયગાળા માટે (કરવેરા અપવાદરૂપ અને/અથવા અસાધારણ આઇ/ગ્રુગ પૂર્વ	6860.56	२३८५५.८३	9004.6			
		9200.92	५३७०.५७	1090.6			
3	ચોખ્ખો નફો સમયગાળા માટે કરતેરા મુજ (1000.8			
		9600.92	4 360.46	0.00			
8	સમયગાળા માટે કરવેરા બાદનો ચોખ્ખો નકો (અપવાદરૂપ અને/અથવા અસાધારણ આઇટમ્સ બાદ)			1090.6			
	અસાધારણ આઇટમ્સ બાદ)	9889.60	४०७०.६४				
4	સમયગાળા માટે કલ એ દેવને આવત (૧૦)		000.50	८५४.उ			
	નફા અને (કરવેરા બાદ)ની અન્ય એકંદર આવક સહિત)		AL ST SERVE S	(a) (asiapa			
	ઇક્વિટી શેર મૂડી						
1	रीअर्व (शत वर्षमा अभीआमां दर्भा)	69.46	(0)				
8	રીઝર્વ (ગત વર્ષના સરવૈયામાં દર્શાવેલ પુનઃમુલ્યાંકન સિવાય) ઇક્વિટી શેર કેપીટલની ફેસ વેલ્યુ		29.46	८७.५८			
	I GO HE INDONE	- 4	3960.86				
1,	ોરદીઠ કમાણી (અસાધારણ આઇટમ્સ પૂર્વે અને બાદ) બેજીક/ડાયલ્યુટેડ :	१/- ३१.	9/- 31.	१/- ३१.			
। :	20 00 1 1 1 2 2 2 1 2 1 2 2 1 2 1 2 2 1 2 1	98.43	४६.५८	€.9€			

નોંદા : ઉપરોક્ત સેબી (લિસ્ટીંગ અને અન્ય ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્ષચેન્જમાં ફાઈલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામોના વિગતવાર ફોર્મેટનો અર્ક છે. ત્રિમાસિક પરિ<mark>ણામો સંપૂર્ણ રૂપે</mark> સ્ટોક એલચેન્જની વેબસાઇટ (www.bseindia.com) તેમજ કંપનીની વેબસાઇટ www.shrijagdamba.com પર પણ ઉપલબ્ધ છે. તારીખ : ૦૯.૧૧.૨૦૨૧ સ્થળ : અમદાવાદ

શ્રી જગદંબા પોલિમર્સ લિ. વતી

આ જેગંદળા ચાલમતા છે. વેલા સહી/-રમાકાંત ભોજનગરવાલા (મેનેજિંગ ડિરેક્ટર) (ડિઆઇએન. ૦૦૦૧૨७૩૩)

- 700 016

Take 1	ESULTS Franzi				
Nu fil	Half Year Ended Sept 2021	Ended	13	(₹ in La Year Ended March 20	1
N M	13,160.75	Manualte		Audited	d
-	270.24	93.5	1	292.72	
-	200.24	93.51	1	304.27 273.48	-
20	233.81	144.10		340.42	
1	320.00	600.00	1	,176.13	
	3.34 3.34	1.44 1.44		4.56 4.56	

fied with BSE Limited under Regulation The full format of the Quarterly/Half and also on the website of the Company,

> For Tai Industries Limited Rohan Ghosh (Managing Director) (DIN:-00032965)

100			(Rs. In Lak
	esults		
N MILE	ed Half Year e 30.09.20	nded 20	Year ending 31.03.2021
H	The second second	ed)	Audited
24	119269.	90	246466.59
7	1190.84	1	2689.57
1	1190.84		2689.57
	909.81		2045.64
	894.98		2051.29
-	2,637.90	1	1,979.90
-	36,110.83	1	25753.08
-			1576-16
1	0:69	1	2.07
	0.69	H. C.	2.07

The full format of the unaudited ended on September 30, 2021 nd other recognised accounting

ul Refoils & Solvent Limited Balvantsinh C. Rajput airman & Managing Director

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા सेन्ट्रल बैंक ओफ इंडिया CENTRAL BANK OF INDIA

સેત્રીય કાર્યાલય, ગાંધીનગર, लाल हरवाका,

પરિશિષ્ટ - ૪ - એ (નિયમ ૮(૬) ની જોગવાઈ જુઓ) સ્થાવર મિલકતોના વેચાણ માટે ની

અગદાવાદ - ૩૮૦૦૦૧. લી ક્ષેક્સુરિશક્ત્રોશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓન્ડ ક્ષેરનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ડ્રોસિંગ્ડ ઓફ સિક્સુરિશક્ત્રોશન એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ડ્ર, ૨૦૦૨ સાથે સિક્સોરિટી લાક્સેટલ (એન્ડ્રોસિંગ્ડ) નિવસો, ૨૦૦૨ના નિવસમાં (ફ) ની જોગવાઈઓ સાથે વંચાણે લેતાં હેઠળ સ્થાવર મિલકતોની ઈ-હરાજીની વેચાળની નોદીસ આથી જોહેર જુનતાને સામાન્ય રીતે અને વિશેષ રીતે કરજદારો અને જામીનદારો ને નોટીસ આપવામાં આવે છે કે ની એ આવે સ્થાવર મિલકતો જે સિસ્પોર્ડ લેગ્રદાર, તેન્દ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે ગિર્સ્ટ સાથે કર્યો હોય છે તે "જ્યાં છે", "જેમ છે" અને "જે કાંઇ છે" તે આધારે કરજદારો અને જામીનદારો પાસેથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકૃત અધિકારીએ લીધો છે તે "જ્યાં ના શર્યા કર્યા કર્યો હોય છે તે "જ્યાં ના શર્યા કર્યા કર્યો હોય છે તે "જ્યાં ના શર્યા કર્યા કર્યો હોય છે તે "જ્યાં ના શર્યા કર્યા કર્યા કર્યા હોય કરતા સામે અનામત કિંમત અને અનેસ્ટ મની ડિપોઝિટ (ઈએમડી) ની રકમ દર્શાવેલ છે.

oi.	કરેજદારો / જામીનદારો / ગીરોકર્તાઓના નામ અને શાખા ની સંપર્ક વિગત	ડિમાન્ડ નોટીર વારીખ અને બાકી રકમ	પાસેથી સેન્દ્રેલ એક ઇન્ડિયાના અધિકૃત અધિક અને અર્નસ્ટ મની ડિપોઝિટ (ઈએમડી) ની રકમ દર્શાવેલ છે. સ્ટ્રોલર મિલકતોનું વર્ણન	અનામત કિંમત અત ૧૦% ઈએમડી
1.	ત્રી મંગલભાઈ કચરાભાઈ કરીજન અને સુક્ષી જયાબેન મંગલભાઈ કરીજન	30/07/2018	The state of the s	કબજાનો
	(૧૦૦સ્ટાટથુટ ઑફ એગ્રી કેમ્પસ શાખા, શ્રી પરાગ જવાલે, અધિકૃત અધિકારી, શ્રો. +91 89800 15872 શ્રી વિકાસ શરણ, મો. +91 99099 28875	Rs. 17,84,756/- + व्याक	રેવેન્યુ સર્વે નં. ૧૧૬/૩, પ્લોટ નં. – ૮, પંચાયત મિલકત નં. – ૩૪૫૫, અમીત નગર સોસાયટી, હકગુડ તાલુકા આણંદ – ૩૮૮૦૦૧	Rs. 6,88,000/- Rs. 68,800/-
	ત્રી કરગોવનભાઈ કાનજીભાઈ રબારી અને માજભાઈ કાનજીભાઈ રબારી અને	09/07/2018	Vale of aa cilya w	869
4 4	પાટણ શાખા, અધિકૃત અધિકારી, દ્યા સી. કે. ગર્ગ, મો. +91 94662 12988 દા કર્ષલ લાક (શાખા મેનેજર) દા +91 99789 76207	1,04,700/-	પ્લીટ નં. – ૨૨, બ્રોસર મુજબ નં. –૧૧, રેવેન્યુ સર્વે નં. ૨૯૦/૧, ગુંગડી પતિ રામદેવ ટાઉનશીપ, રાજપૂત શેસ્ટેલ પાસે, કેનાલ રોડ, ઉજા ત્રણ રસ્તા, પાર્થ રેઝીક્સ્સ્સ્થી આપે.	Rs. 11,01,000/- Rs. 1,10,100/-
12	મિતી બબીબેન કે ચૌધરી અને શ્રી નજીભાઈ જી ચૌધરી	-41.8	1 - 3 - 3 - 3 - 3 - 3 - 3 - 3 - 3 - 3 -	પ્રત્યક્ષ કબજો
श्री श्री	ાટલ શાખા, અધિકૃત અધિકારી,	/-+	પ્લોટ નં. – ૨૧, બ્રોસર મુજબ નં. –૧૨, રેવેન્યુ સર્વે નં. ૨૯૦/૧, ગુંગડી પતિ રામદેવ ટાઉનશીપ, l રોજપૂત દોસ્ટેલ પાસે, કેનાલ રોડ, ઉજા ત્રણ રસ્તા, શર્થ રેસીડન્સી સામે, પાટણ – ૩૮૪૨૬૫.	is. 11,12,000/- is. 1,11,200/-

નિરીસણના તારીખ અને સમયઃ ૧૫.૧૧.૨૦૨૧ ના રોજ બપોરના ૧૨.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ઇએમડી અને દસ્તાવેજો(ઓનલાઇન) જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમયઃ ૨૪.૧૧.૨૦૨૧ ના રોજ સાંજના ૪.૦૦ સુધી ઈ-હરાજી તા. ૨૫.૧૧.૨૦૨૧, સમય બપોરના ૧૨ થી ૨ સુધી ૧૦ મિનિટના ઓટો એક્સ્ટેન્શન સાથે